

| बैंक ऑफ इंडिया<br><b>Bank of India</b><br><i>Relationship Beyond Banking</i>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    | <b>Paldi Branch,</b><br>Ground Floor, Sharda Ashish Building, 2B, Anun Society,<br>Mahalaksmi Cross Road, Paldi, Ahmedabad - 380007.<br>Ph. 079-26577931 / 26578226<br><b>E-mail:-</b> paldi.ahmedabad@bankofindia.co.in                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           | <h1 style="margin: 0;">DEMAND NOTICE</h1>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               |                                                                                                                                                     |
|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| <p>The under mentioned account bears N.P.A. and demand notice issued by the Bank to the Borrower under Section 13(2) of Securitisation &amp; Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act (The Act) 2002 &amp; Sent by Regd. Post was returned unserved with remarks "<b>Left"</b> to the below mentioned Borrower.</p> <p style="text-align: right;"><b>Annuexe-A</b></p>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |                                                                                                                                                     |
| Name of the Borrower & Gaurantor                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | Date of Demand Notice                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              | Nature of Facility                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      | Details of Secured Asset                                                                                                                            |
| (1) M/s. Nilkanth Engineering<br>Plot No. 72/A, Prince Industrial Hub, at Water Tank, Ahmedabad Indore Express Highway, At Village Kuha, Taluka Dascroi, District Ahmedabad - 382433<br><br>(2) Mr. Teelaran Bholaram Rathore (Partner)<br>1734, 2nd Floor, 1st Main Srinivas Nagar, Bangalore, South Basahankari, Bangalore, Karnataka- 560050<br><br>(3) Mr. Budharam Tukharani (Partner)<br>Ambica Bankers, No. 238, 2nd Cross, 1st Main, Sanjeevani Nagar, Heggarhalli, Bengaluru, Karnataka- 560061<br><br>(4) Mr. Chandrarani Kaluramiji (Partner)<br>HaleyyurExt, Chanchannakatte Hobli, K R Nagara, Thaluku, Hosuru, Mysore, Karnataka - 571617<br><br>(5) Mr. Jigneshkumar Chimanbhai Patel (Partner)<br>B-16, Shreedhar Bungalows, Nr. Ayush Tenament, Opp. Aditya Complex, Nikol Gam Road, Nikol, Ahmedabad - 382350 | 02.06.2023<br><br><br><br><br><br><br><br><br><br><br><b>Date of NPA</b><br>27.07.2022                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             | <b>(A) Cash Credit</b> 2011301100000084<br><b>(B) Term Loan</b> 2011704100000071<br><b>(C) Term Loan</b> 2011704100000078<br><b>(D) Term Loan</b> 2011704100000079<br><br><div style="border: 1px solid black; padding: 5px; margin-top: 10px;"> <b>Sanctioned Limit</b><br/><br/>             Rs. 5,00,000/-<br/>             Rs. 14,00,000/-<br/>             Rs. 65,00,000/-<br/>             Rs. 14,00,000/-<br/><br/> <b>Outstanding Dues</b><br/><br/>             Rs. 5,34,945.39/-<br/>             Rs. 11,01,177.11/-<br/>             Rs. 55,51,104.98/-<br/>             Rs. 11,77,431.67/-           </div> | Plot No. 72/A, Prince Industrial Hub, at Water Tank, Ahmedabad Indore Express Highway, At Village Kuha, Taluka Dascroi, District Ahmedabad - 382433 |
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | <p>Borrower/Guamtors are hereby informed that Authorised Officer of the Bank shall upon provision of SARFAESI Act, take Possession and subsequently auction the Mortgage Property / Secured assets as mentioned above if the Borrower do not pay the amount as mentioned above within 60 days from the date of publication of this notice. The Borrower/Guamtors are also prohibited under section 13(13) of SARFAESI Act to transfer by sale, lease or otherwise the said secured assets stated above without obtaining written consent of the Bank. This public notice is to be treated as notice u/s 13(2) of the SARFAESI Act, 2002.</p> <p><b>The said Notice is pasted at the property on 29.07.2023</b></p> <p>Borrower/Guamtors is advised to collect the original notice issued under Section 13 (2) from the undersigned on any working day by discharging valid receipt. The borrower's attention is invited to the provisions of Sub-section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.</p> <p><b>Date : 14.08.2023, Place : Ahmedabad</b></p> |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |                                                                                                                                                     |
|                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 | <b>Sd/-</b><br><b>Authorised Officer, Bank of India</b>                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         |                                                                                                                                                     |

|                             |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | <b>SAMBHAAV MEDIA LIMITED</b><br>(CIN: L67120GJ1990PLC014094)                                                                                   |            | <b>Registered Office:</b> "Sambhaav House", Opp. Judges' Bungalows, Premchandnagar Road, Satellite, Ahmedabad - 380 015<br><b>Phone:</b> +91 79 2687 3914/15/16/17 <b>Fax:</b> +91 79 2687 3922<br><b>Email:</b> secretarial@sambhaav.com <b>Website:</b> www.sambhaav.com |            |               |            |            |            |
|---------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------|---------------|------------|------------|------------|
| <b>EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER ENDED ON JUNE 30, 2023</b> |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                |                                                                                                                                                 |            |                                                                                                                                                                                                                                                                            |            |               |            |            |            |
| (₹ in Lakhs Except EPS)                                                                                       |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                |                                                                                                                                                 |            |                                                                                                                                                                                                                                                                            |            |               |            |            |            |
| SN                                                                                                            | Particulars                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    | Standalone                                                                                                                                      |            |                                                                                                                                                                                                                                                                            |            | Consolidated  |            |            |            |
|                                                                                                               |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | Quarter Ended                                                                                                                                   |            | Year Ended                                                                                                                                                                                                                                                                 |            | Quarter Ended |            | Year Ended |            |
|                                                                                                               |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | 30-06-2023                                                                                                                                      | 31-03-2023 | 30-06-2022                                                                                                                                                                                                                                                                 | 31-03-2023 | 30-06-2023    | 31-03-2023 | 30-06-2022 | 31-03-2023 |
|                                                                                                               | (Refer Notes below)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | Unaudited                                                                                                                                       | Audited    | Unaudited                                                                                                                                                                                                                                                                  | Audited    | Unaudited     | Audited    | Unaudited  | Audited    |
| 1                                                                                                             | Total Income from Operations (net)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                             | 662.62                                                                                                                                          | 970.76     | 1,151.48                                                                                                                                                                                                                                                                   | 4,020.90   | 664.12        | 970.75     | 1,151.48   | 4,033.25   |
| 2                                                                                                             | Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional items)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              | (236.63)                                                                                                                                        | 107.62     | (128.28)                                                                                                                                                                                                                                                                   | 9.74       | (242.41)      | 102.66     | (178.05)   | (66.32)    |
| 3                                                                                                             | Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         | (236.63)                                                                                                                                        | 107.62     | (48.28)                                                                                                                                                                                                                                                                    | 89.74      | (252.45)      | 105.52     | (155.03)   | (37.30)    |
| 4                                                                                                             | Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                          | (164.25)                                                                                                                                        | 74.24      | (73.38)                                                                                                                                                                                                                                                                    | (14.06)    | (178.70)      | 72.03      | (170.17)   | (124.51)   |
| 5                                                                                                             | Net Profit/(Loss) from discontinued operations after tax                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       | (3.57)                                                                                                                                          | (80.01)    | (53.61)                                                                                                                                                                                                                                                                    | (135.58)   | (3.57)        | (80.01)    | (53.61)    | (135.58)   |
| 6                                                                                                             | Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    | (167.74)                                                                                                                                        | (5.97)     | (129.45)                                                                                                                                                                                                                                                                   | (152.62)   | (182.19)      | (8.18)     | (223.62)   | (260.44)   |
| 7                                                                                                             | Equity Share Capital (Face Value of ₹ 1/- per share)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           | 1,911.11                                                                                                                                        | 1,911.11   | 1,911.11                                                                                                                                                                                                                                                                   | 1,911.11   | 1,911.11      | 1,911.11   | 1,911.11   | 1,911.11   |
| 8                                                                                                             | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            | -                                                                                                                                               | -          | -                                                                                                                                                                                                                                                                          | 6,297.92   | -             | -          | -          | 6,349.20   |
| 9                                                                                                             | Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 |                                                                                                                                                 |            |                                                                                                                                                                                                                                                                            |            |               |            |            |            |
|                                                                                                               | Basic and diluted EPS before Exceptional items (₹) -Continuing operations                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                      | (0.09)                                                                                                                                          | 0.04       | (0.08)                                                                                                                                                                                                                                                                     | (0.05)     | (0.09)        | 0.04       | (0.10)     | (0.08)     |
|                                                                                                               | Basic and diluted EPS before Exceptional items (₹) -Discontinuing operations                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                   | (0.00)                                                                                                                                          | (0.04)     | (0.03)                                                                                                                                                                                                                                                                     | (0.07)     | (0.00)        | (0.04)     | (0.03)     | (0.07)     |
|                                                                                                               | Basic and diluted EPS after Exceptional items (₹)                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                              | (0.09)                                                                                                                                          | (0.00)     | (0.07)                                                                                                                                                                                                                                                                     | (0.08)     | (0.10)        | (0.00)     | (0.12)     | (0.14)     |
| 1                                                                                                             | The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on August 12, 2023 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at <a href="http://www.bseindia.com">www.bseindia.com</a> and <a href="http://www.nseindia.com">www.nseindia.com</a> and also on the Company's website at <a href="http://www.sambhaav.com">www.sambhaav.com</a> . |                                                                                                                                                 |            |                                                                                                                                                                                                                                                                            |            |               |            |            |            |
| <b>Place : Ahmedabad</b><br><b>Date : August 12, 2023</b>                                                     |                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                | <b>For and on behalf of the Board of Directors</b><br><b>Manoj B Vadodaria</b><br><b>Chairman and Managing Director</b><br><b>DIN: 00052053</b> |            |                                                                                                                                                                                                                                                                            |            |               |            |            |            |

| Sr. No. |    | Particulars                                                                                                    | Standalone    |            |            |            | Consolidated  |            |            |            |
|---------|----|----------------------------------------------------------------------------------------------------------------|---------------|------------|------------|------------|---------------|------------|------------|------------|
|         |    |                                                                                                                | Quarter ended |            | Year ended |            | Quarter ended |            | Year ended |            |
|         |    |                                                                                                                | 30.06.2023    | 31.03.2023 | 30.06.2022 | 31.03.2023 | 30.06.2023    | 31.03.2023 | 30.06.2022 | 31.03.2023 |
|         |    |                                                                                                                | Unaudited     | Audited    | Unaudited  | Audited    | Unaudited     | Audited    | Unaudited  | Audited    |
| 1       |    | Total Income                                                                                                   | 4,719.89      | 8,023.67   | 4,491.00   | 24,772.26  | 4,719.89      | 8,023.78   | 4,491.00   | 24,772.97  |
| 2       |    | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)                      | 262.89        | 911.93     | 541.50     | 2,428.10   | 275.64        | 911.29     | 540.82     | 2,433.81   |
| 3       |    | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)                   | 262.89        | 911.93     | 541.50     | 2,428.10   | 275.64        | 911.29     | 540.82     | 2,433.81   |
| 4       |    | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)                    | 178.83        | 719.50     | 429.99     | 1,907.49   | 191.59        | 718.80     | 429.31     | 1,913.14   |
| 5       |    | Total Comprehensive income for the period                                                                      | 931.48        | (931.08)   | 1.12       | 476.02     | 959.15        | (852.77)   | 0.44       | 560.68     |
| 6       |    | Equity share capital (Face Value of Rs 10/- each)                                                              | 1,233.44      | 1,233.44   | 1,233.44   | 1,233.44   | 1,233.44      | 1,233.44   | 1,233.44   | 1,233.44   |
| 7       |    | Reserve and Surplus (excluding Revaluation Reserve)                                                            | -             | -          | -          | 32,383.93  | -             | -          | -          | 32,387.64  |
| 8       |    | Earnings Per Share (EPS) (of Rs. 10 Each) (Not annualized for Quarters) (Including Other Comprehensive Income) |               |            |            |            |               |            |            |            |
|         | a) | Basic                                                                                                          | 7.55          | -7.55      | 0.01       | 3.86       | 7.78          | -6.91      | 0.004      | 4.55       |
|         | b) | Diluted                                                                                                        | 7.55          | -7.55      | 0.01       | 3.86       | 7.78          | -6.91      | 0.004      | 4.55       |

**Note:**

- The above financial results have been reviewed by the Audit committee and approved by the Board of Directors at its meeting held on August 12, 2023. The standalone and consolidated financial results of the Company have been reviewed by the Statutory Auditors of the company.
- These financial results have been prepared in accordance with applicable Indian Accounting Standards ("Ind As") notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended, as specified in section 133 of the Companies Act, 2013.
- The company has received no complaint during the period & pending complaint as on August 12, 2023 is Nil.
- Previous period figures have been regrouped/rearranged whenever necessary for comparison purposes.
- The Financial Results are available on the BSE Limited website [www.bseindia.com](http://www.bseindia.com) & on the company's website [www.metrogloballimited.com](http://www.metrogloballimited.com)

**For and on behalf of Board of Metroglobal Limited**

Sd/-

(Gautam M. Jain)

Chairman & Managing Director

DIN: 00160162

Date: August 12, 2023

Place: Ahmedabad





સ્થાનિકો દ્વારા નવા ફ્લાયઓવરની માગ છતાં સરકાર દ્વારા થાગડથીગડથી ચલાવાતી કામગીરી

# ભાલેજ બ્રીજ પર ખાડાથી અકસ્માતની ભીતિ

## સામરખાચોકડી સુધી આ જ સ્થિતી: સરકાર દ્વારા મા.મ. વિભાગને ફાળવેલા રૂ. ૩ કરોડ ક્યાં?

આણંદ, તા. ૧૩

સાડાત્રણ દાયકા પૂર્વ શહેરને સામરખાચોકડીથી એક્ષપ્રેસ હાઇવે જોડતો ભાલેજબ્રીજ સાકાર બાદ સતત વધતા વાહનોના આવાગમન ભારણ પગલે છેલ્લા કેટલાક સમયથી બિસ્માર બનવા પામતાં સ્થાનિકો દ્વારા નવા ફ્લાયઓવરની માગ છતાં સરકાર દ્વારા થાગડથીગડથી બ્રીજ મજબૂતી માટે પાંચ માસ પૂર્વ ત્રણ કરોડની ફાળવણી કરી હતી. પરંતુ હાલમાં બ્રીજ પરના માંગેનું ધોવાણ થતાં ડેરેટર ખાડા ઠેઠ સામરખાચોકડી સુધીના માંગે પર હોવા છતાં માંગે મકાન વિભાગ દ્વારા બ્રીજનું મજબૂતાઈ કે માંગેનું રિકાપ્ટીંગ કરવામાં ન આવતાં ત્રણ કરોડની કરવામાં આવેલ ફાળવણી શું ગાય ચરી ગઈ? ના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત



વિગત અનુસાર સાડાત્રણ દાયકા પૂર્વે આણંદને સામરખાચોકડીથી એક્ષપ્રેસ હાઇવેને જોડતો ભાલેજબ્રીજ નિર્માણ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં વધતા જતા વાહન આવાગમન ભારણના કારણે બ્રીજ બિસ્માર બનતાં તથા બ્રીજ દિમાર્ગીના કારણે છાશવારે ટ્રાફિક જામ તથા અકસ્માતના બનતાં બનાવ પગલે સ્થાનિકો દ્વારા બ્રીજ પહોળો કરવા અથવા નવા ફ્લાયઓવરની માગ કરવામાં

આવતાં રાજ્ય સરકાર દ્વારા પાંચ માસ પૂર્વે માગેમકાન વિભાગને બ્રીજને થાગડથીગડથી મજબૂત કરવા રૂપિયા ૩ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં શુષ્કતા સેવતા હાલમાં બ્રીજ પરનો માંગે ખખડધજ બની ઠેરઠેર ખાડા ઉપરાંત ઠેઠ સામરખાચોકડી સુધીના માંગે ખાડા માંગે બનતાં શું સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ત્રણ કરોડની રકમ શું ગાય ચરી ગઈ? ના

## આણંદને વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નેતાગીરી નિષ્ફળ કે સરકારમાં ઉપજતું નથી?

આણંદ જીલ્લો અસ્તિત્વમાં આવ્યાબાદ આજે અહીં દાયકા બાદ પણ શહેરમાં વિકાસ સુવિધાઓથી વંચિત રહેવા પામી રહ્યું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો દ્વારા ભાલેજબ્રીજ ની સમસ્યા ના ઉકેલ માટે માગ કરવામાં આવતી હોવા છતાં ગઈ ભેંસ પાણીમાની સ્થિતી સર્જોવા પામતી હોય નેતાઓ દ્વારા સરકારમાં રજૂઆત ક્યાંના આશ્વાસન આપવામાં આવે અને બાદમાં પરિસ્થિતિ યથાવત રહે ત્યારે શું નિષ્ફળ નેતાગીરી કે ઉપર કાઠ ઉપજતું નથી? ના સવાલ ભાલેજબ્રીજ સહિત અપૂર્ણ ભૂગર્ભ ગટરયોજના, અત્યાધુનિક બસમથક, આણંદને મહાપાલિકાનો દરજ્જો, એસટીપી પ્લાન્ટ, નવી ડી. પી., ટી. પી. જેવી અનેક સુવિધા વંચિત પાછળ સરકારની મનસા કે ઉપેક્ષા પર સવાલ થવા પામી રહ્યાનું જાણવા મળેલ છે.

સવાલ સાથે બ્રીજની દિવાલ પર ડેરેટર ઝાડીઝાંખરા ઉગી નીકળતા તેના મુળીયા ઉડા ઉતરતાં દિવાલ ધરાશયી બનવા પામે તેવી ભિતી પણ સ્થાનિકો દ્વારા સેવવામાં આવી રહી છે. ત્યારે જો ભાલેજબ્રીજ જતકતાકા માંગે પર તોડફોડ કરી

રાજ્ય વિધાનસભા જંગ બાદ અન્ય વિસ્તારના

# વોર્ડમાં કામની ફાંકા ફોજદારી કરતાં નેતાઓના વોર્ડે નં. ૪ સ્કૂલ માર્ગ ઉપરની મંજૂરી જ ગાયબ

આણંદ, તા. ૧૩

રાજ્ય વિધાનસભા જંગ બાદ અને તે પૂર્વ શહેરના લઘુમતી વોર્ડ વિસ્તારમાં પાલીકા દ્વારા વિવિધ સુવિધા ઉભી કરવામાં આવતાં કેટલાક નેતાઓ અમારા કહેવાથી કામ થયાની ફાંકાફોજદારી કરતાં નેતાઓના વોર્ડેનં ૪ વિસ્તારમાં જ ભાલેજબ્રીજથી માણેજવાલા સ્કૂલ તરફના બિસ્માર માંગેના નવીનીકરણ માટે પાલીકા દ્વારા મંજૂરી આપવામાં આવ્યાબાદ મંજૂરી જ ગાયબ થતાં માંગે સ્થિતી યથાવત રહેતાં કોની શુષ્કતા? જેવા સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા કેટલાક સમયથી શહેરના ભાલેજબ્રીજ નજીક ના સર્વિસ માંગે થઈ માણેજવાલા સ્કૂલ તરફ જતો માંગે હોય તે બિસ્માર બનતાં વાહનચાલકો તથા સ્કૂલમાં જતાં વિદ્યાર્થીઓ માટે પણ



આવાગમન દુષ્કર બનતાં કેવી રીતે ભણશે ગુજરાત ના સવાલ સાથે માંગે નવીનીકરણની માગ ઉઠવા પામી હતી. જે તાજેતરમાં વરસેલ વરસાદના પગલે માંગે પર પાણી ભરાતાં પાલીકા દ્વારા છારૂટેબા પાથરી હંગામી સુવિધા આપવામાં આવી. પરંતુ તે પુનઃ ખાડામાં જતાં સાથે પાલીકા દ્વારા અગાઉ સદર

માંગેના નવીનીકરણ માટે સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં પાલીકા સુચના જણાવ્યા પ્રમાણે પાલીકા દ્વારા આપવામાં આવેલ મંજૂરીને જ ગાયબ કરવામાં આવતાં આ મુદ્દે કોણ જવાબદાર? કે ફાંકાફોજદારી કરતાં નેતાઓની શુષ્કતા? ના સવાલ ચર્ચામાં હોવાનું જાણવા મળેલ છે.

દેશપ્રેમ ઉભો કરવાનું આયોજનકે પછી વ્યાપારીકરણ?

# મધ્યાહ્ન ભોજન સંચાલકો અને રાશનદુકાન સંચાલકોને દશ તિરંગા લેવાના આદેશ

આણંદ, તા. ૧૩

દેશપ્રેમ દેશદાઝ ની ભાવના પ્રજ્વલિત રહે તેવા આશયથી ગતવર્ષથી સરકાર દ્વારા હર ધર તિરંગા ના આયોજન પગલે આ વર્ષે પંદરમી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિને આયોજન હાથ ધરતાં આણંદના તંત્રાધીકારીઓ દ્વારા મધ્યાહ્ન ભોજન સંચાલકો તથા રાશનની દુકાનના સંચાલકોને દશ તિરંગા લેવાની અને રૂપિયા ૨૫૦ વસુલવાના પગલે નારાજગી પ્રવર્તવા સાથે આ તે કેવા દેશપ્રેમ ઉભા કરવાના આયોજન? ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર દેશ આઝાદ થયાને ૭૬ વર્ષ પૂર્ણ થવા સાથે આગામી ૧૫ ઓગષ્ટે ૭૭માં વર્ષમાં પ્રવેશ કરશે. જેના પગલે ગતવર્ષના સરકાર દ્વારા દેશની જનતામાં દેશપ્રેમ દેશદાઝની ભાવના પ્રજ્વલિત રહે તેવા આશયથી હરધરતિરંગાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આગામી ૧૫મી ઓગષ્ટે



પુનઃ હરધરતિરંગાનું આયોજન હાથ ધરવામાં આવતાંના પગલે આણંદ તંત્રાધીકારીઓ દ્વારા મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકો તથા રાશનની દુકાન ધરાવતા સંચાલકોને દશ તિરંગા મેળવી રૂપિયા ૨૫૦ વસુલતા બંને સંચાલકોમાં નારાજગી પ્રવર્તવા પામી હોવા સાથે આ તે કેવા દેશપ્રેમની તિરંગાનું વ્યાપારીકરણ કરી ભાવના ઉભી કરવામાં આવી રહી છે તેવા સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે.

અધિક માસ નિમિત્તે રવિવાર મુખ્યમંત્રી વડતાલ મંદિરની મુલાકાતે

# મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવ દર્શન કર્યા બાદ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી



વડતાલ, તા. ૧૩

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિક માસ નીમીત્તે રવિવારે વડતાલ સ્વામીનારાયણમંદિરમાં બિરાજમાન દેવોના દર્શને પધાર્યા હતા. ગુજરાતના પત્રોતા પુત્ર અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રપટેલ વડતાલ મંદિરે આવતા મુખ્યકોઠારી ડૉ. સંતસ્વામીએ ફુલહાર પેહરાવી



સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મુખ્ય કોઠારીએ મુખ્ય મંત્રીને વડતાલ મંદિરમાં બીરાજમાન દેવોના દર્શને લઈ ગયા હતા. જ્યાં મુખ્યમંત્રીએ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી દેવો ના દર્શનબાદ મુખ્યમંત્રી વડતાલમંદિરના કોઠારીની ઓફીસમાં પધાર્યા હતા.

ગળતેશ્વરના વાડદમાં ઉમરેઠ અલ-નાઝ

# હોસ્પિટલ દ્વારા મફત નિદાન કેમ્પ યોજાયો



આણંદ, તા. ૧૩

ઠાસરા ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતે શેખ સમાજ તથા વાડદ મસ્જીદ કમિટીના સંયુક્ત ઉપક્રમે અલ-નાઝ હોસ્પિટલ ઉમરેઠ દ્વારા યોજાયેલ મફત નિદાન કેમ્પ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલ-નાઝ હોસ્પિટલના ડોક્ટર ઈસતીયાક એ. બેલીમ, એમ. બી. બી. એસ. (એમ. ડી. યુ. એ. દ્વારા મફત સેવા આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં વાડદ શેખ સમાજના પ્રમુખ તથા ઉપ પ્રમુખ તેમજ શેખ ગુલામ મૈયુદીન એ. શેખ ઝાકીર મિયા એ. શેખ સલીમ એહમદ

એ. શેખ યુસુફ મિયા યુ. શેખ આરિફ હુસૈન વાય (બકા), શેખ હસન મિયા આર. શેખ આસીફ મિયા આઈ. શેખ મુખત્યાર મિયા એસ. શેખ ઈમ્તિયાઝ મિયા એસ. શેખ ઈરફાન મિયા બી. ઈલ્યાસ મિયા એસ. મુસ્તુફા એમ. એલ. એ. ઈરફાન બી. બેલેન્સવાળા તથા ઠાસરા ગળતેશ્વર તાલુકાના શેખ સમાજના પ્રમુખ હેબૂબ મિયા શેખ, તથા ઝાકીરભાઈ રાજવન હાજર રહ્યા હતા. આ કેમ્પમાં આશરે ૨૫૦ થી ૩૦૦ ગરીબ દર્દીઓએ કોઈપણ નાતજાતના ભેદભાવ વગર આ કેમ્પનો લાભ લીધો હતો.

અમૂલની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાય : પદાધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા

# ડેરીનુ ટર્નઓવર ૧૧ કરોડ ઉપરાંત અને ગતવર્ષ કરતાં ૧૪.૨૩% વૃદ્ધિ દરને આંબ્યું

આણંદ, તા. ૧૩

ગતસદીના ચાલીસમા દાયકામાં એકતરફ દેશ આઝાદીના નારા બુલંદ બની રહ્યા હતા તેની વચ્ચે દેશ આઝાદ થવાના આરંભ હોય તેવા અંદેશા સાથે સરદાર પટેલે સહકારી પ્રવૃત્તિને ઉભી કરી સહકારી માળખું બને અને તેના દ્વારા ખેડૂતો પશુપાલકો પગભર બને તેવી વિચારધારાની પ્રેરણાથી આણંદ ખાતે ૭૭ વર્ષ પૂર્વ ત્રિભુવનદાસ પટેલ, ડો. કુરીયન સહિત અન્ય સહકારી માધાંતાઓ દ્વારા ખેડાજીલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરી જે બીજ વાવેલું હતું તે બાદમાં ઓળખ પામેલ અમૂલ આજે ૭૭માં વર્ષે વટવૃક્ષ બનતાં ડેરીની યોજાયેલ ૭૭મી વાર્ષિક સાધારણ સભામાં ટર્નઓવર રૂપિયા ૧૧,૮૦૩ કરોડ



જે ગતવર્ષ કરતાં ૧૪.૨૩%ના વૃદ્ધિ દરને આંબતા આગામી વર્ષે ટર્નઓવર ૧૭૭ કરોડને આંબશેનો વિશ્વાસ અમૂલના ચેરમેન વિપુલ પટેલે વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદન વધારવા તથા પશુ સ્વાસ્થ્ય સુધારવા નવી ટેકનોલોજી અપનાવી વેટરનરી સેવાઓ માં વધારો કરવામાં આવ્યો છે. સરકારની ગોબરધન બાયોગેસ યોજના અંતર્ગત વિવિધ ગામડામાં ૬૦૦


જેટલા સ્થાપવામાં આવ્યા છે. જે આગામી વર્ષે પહોંચશે લક્ષ્યને આંબશે. સાથે સાથે અન્ય પ્રોડક્ટ જેવી કે આટા, નુડલ્સ, ટોમેટો કેચઅપ, એનર્જી ડ્રીક વીપ્સ તથા માયોનીઝ જેવી પ્રોડક્ટ બજારમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત પ્લાન્ટની ઉત્પાદનક્ષમતા વધારવા પ્લાન્ટના વિસ્તરણ કરવામાં આવશે. આ ઉપરાંત નવા પ્લાન્ટ રાજ્ય તથા રાજ્ય બહાર ઉભા કરવા આયોજન કરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ડેરીના વોઈસચેરમેન કાન્તીભાઈ સોદાપરમાર, પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર, અન્ય ડીરેક્ટર અમૂલ એમ. ડી. એમની વ્યાસ સહિત આણંદ, ખેડા, મહિસાગર જીલ્લાની વિવિધ દૂધમંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

# ઓડિટર ફર્મ ડેલોઈટ એડાણી ગ્રૂપમાંથી રાજનામું આપ્યું

મુંબઈ, તા. ૧૩

અદાણી પોર્ટ્સ એન્ડ સેઝની ઓડિટર ફર્મ ડેલોઈટ હાસિન્કસ એન્ડ સેલ્સ એવેલેપી એ કંપનીના ઓડિટર પદથી રાજનામું આપ્યું છે. જ્યારે આ કંપની એમએસકેએ એન્ડ એસોસિએટ્સ દ્વારા બદલવામાં આવશે, જ્યે નવા ઓડિટર તરીકે તેની નિમણૂકની પુષ્ટિ કરી છે. ડેલોઈટ ૨૦૧૭થી ઓડિટરનું કામ સંભાળી રહી હતી

જુલાઈ ૨૦૨૨માં તેને પાંચ વર્ષની બીજી મુદત આપવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, અદાણી ગ્રૂપે શનિવારે જણાવ્યું હતું કે તેના ઓડિટર તરીકે રાજનામું આપવાના ડેલોઈટના કારણો યોગ્ય નથી, તેમણે ઉમેર્યું હતું કે ડેલોઈટ દ્વારા કંપની છોડવા માટે આપવામાં આવેલા કારણો બહુ વિશ્વાસપાત્ર ન હતા. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના નવા ઓડિટરની નિમણૂક કરાઈ. ભારતમાં એકાઉન્ટિંગ સેવાઓ રાજના કરે છે. તે બીડીઓ ઈન્ટરનેશનલની સ્વતંત્ર સભ્ય પેઢી છે, જે ટોચની છ વૈશ્વિક ઓડિટ કંપનીઓમાંની એક છે. એવું માનવામાં આવે છે કે આની પાછળ હિંડનબર્ગ રિપોર્ટ છે, જેમાં કેટલાક ટ્રાન્ઝેક્શન પર સવાલ



ઉઠાવવામાં આવ્યા હતા. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને મોટું નુકસાન થયું હતું. તેનું મૂલ્ય લગભગ ડોલર ૧૫૦ બિલિયન ઘટી ગયું હતું, પરંતુ તેનું દેવું ચૂકવીને અને રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવ્યા બાદ તેણે ગુમાવેલી જમીન પાછી મેળવી છે. હિંડનબર્ગ રિસર્ચે તેના ૨૪ જાન્યુઆરીના અહેવાલમાં અદાણી જૂથ સામે છતરપિંડી, સ્ટોક મેનિપ્યુલેશન અને મની લોન્ડરિંગના આરોપો મૂક્યા હતા. અદાણી ગ્રૂપે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ડેલોઈટ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ૨૦૧૦માં, ડેલોઈટે કંપનીના ખાતાઓ પરની તેની કોમેન્ટ્રીમાં ત્રણ સોદા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, ડેલોઈટે જણાવ્યું હતું કે તે કંપનીના નિવેદનને ચકાસી શકતી નથી કારણ કે દાવાઓને સમર્થન આપવા માટે કોઈ સ્વતંત્ર બાહ્ય તપાસ નથી.

# શ્રીલંકામાં આઈએમએફ સપ્ટેમ્બરમાં બેલઆઉટ પ્રોગ્રામની સમીક્ષા કરશે : નાણામંત્રી

કોલંબો, તા. ૧૩

શ્રીલંકાના નાણાપ્રધાન રણજિત શ્યામાબાલાપીટીયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) ૧૧ થી ૧૯ સપ્ટેમ્બર સુધી ટાપુ રાષ્ટ્ર માટે ડોલર ૨.૮ બિલિયનના બેલઆઉટ પેકેજની તેની પ્રથમ સમીક્ષા કરશે. તેમણે એમ પણ કહ્યું કે દેશે વૈશ્વિક વિશ્વાસની દ્વારા નિર્ધારિત નવ શરતો સફળતાપૂર્વક પૂરી કરી છે. જેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. દેશનું વિદેશી મુદ્રા ભંડાર અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગયું છે. જેના કારણે ઈંધણ, ખાદ્ય તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સામે જનતા રસ્તા પર ઉતરી આવી હતી. જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ આ વર્ષે માર્ચમાં મંજૂર કરાયેલા ડોલર ૨.૮ બિલિયન બેલઆઉટની તેની પ્રથમ સમીક્ષા હાથ ધરશે ત્યારે આકાર લેશે. સિયામ્બલપીટીયાએ જણાવ્યું હતું કે આઠ દિવસીય સમીક્ષા ૧૧ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે. કેન્દ્રીય બેંક, નાણા મંત્રાલય અને નાણામંત્રી સમીક્ષામાં સામેલ થશે. ‘અમારે નવ પૂર્વ શરતો પૂરી કરવાની હતી જે અમે સફળતાપૂર્વક પૂરી કરી છે. ૨૦૨૭ સુધી આઠ હપ્તા કરવાની વ્યવસ્થા હતી.



# NILA INFRASTRUCTURES LIMITED

(CIN : L45201GJ1990PLC013417)

**Registered Office:** 1st Floor, Samhaav House, Opp. Chief Justice's Bungalow, Bodakdev, Ahmedabad - 380 015.

**Phone:** +91 79 4003 6817/18 **Fax:** +91 79 26873922

**E-mail:** secretarial@nilainfra.com **Website:** www.nilainfra.com

## EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER ENDED ON JUNE 30, 2023

(₹ in Lakhs Except EPS)

| SN | Particulars                                                                                                                                 | Standalone    |            |            |            | Consolidated  |            |            |            |
|----|---------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------|------------|------------|------------|---------------|------------|------------|------------|
|    |                                                                                                                                             | Quarter Ended |            | Year Ended |            | Quarter Ended |            | Year Ended |            |
|    |                                                                                                                                             | 30-06-2023    | 31-03-2023 | 30-06-2022 | 31-03-2023 | 30-06-2023    | 31-03-2023 | 30-06-2022 | 31-03-2023 |
|    | (Refer Notes below)                                                                                                                         | Unaudited     | Audited    | Unaudited  | Audited    | Unaudited     | Audited    | Unaudited  | Audited    |
| 1  | Total Income from Operations                                                                                                                | 2,784.46      | 4,631.41   | 1,659.68   | 12,819.79  | 2,774.94      | 4,618.31   | 1,644.11   | 12,709.64  |
| 2  | Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional items)                                                                           | 74.10         | 50.92      | 32.94      | 288.07     | 67.68         | 38.30      | 21.40      | 190.04     |
| 3  | Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items)                                                                      | 74.10         | 50.92      | 32.94      | 288.07     | 67.68         | 38.30      | 21.40      | 190.04     |
| 4  | Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)                                                                       | 45.05         | 28.52      | 7.21       | 177.32     | 22.72         | 1.93       | (45.93)    | (44.96)    |
| 5  | Total Comprehensive Income for the period (Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | 45.05         | 31.25      | 7.21       | 180.05     | 22.72         | 4.66       | (45.93)    | (42.23)    |
| 6  | "Equity Share Capital (Face Value of ₹1/- per share)"                                                                                       | 3,938.89      | 3,938.89   | 3,938.89   | 3,938.89   | 3,938.89      | 3,938.89   | 3,938.89   | 3,938.89   |
| 7  | Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)                                                          | -             | -          | -          | 10,890.57  | -             | -          | -          | 9,324.44   |
| 8  | Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)                                                              |               |            |            |            |               |            |            |            |
|    | Basic (in ₹)                                                                                                                                | 0.01          | 0.01       | 0.00       | 0.05       | 0.01          | 0.00       | (0.01)     | (0.01)     |
|    | Diluted (in ₹)                                                                                                                              | 0.01          | 0.01       | 0.00       | 0.05       | 0.01          | 0.00       | (0.01)     | (0.01)     |

1 The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on August 12, 2023 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) and also on the Company's website at [www.nilainfra.com](http://www.nilainfra.com).

**Place : Ahmedabad**

**Date : August 12, 2023**

**By Order of the Board of Directors**

**Manoj B Vadodaria**

**Chairman and Managing Director**

**DIN: 00092053**



**SAMBHAAV  
GROUP**

**SAMBHAAV MEDIA LIMITED**

(CIN: L67120GJ1990PLC014094)

**Registered Office:** "Sambhaav House", Opp. Judges' Bungalows, Fremchchandnagar Road, Satellite, Ahmedabad - 380 015

**Phone:** +91 79 2687 3914/15/16/17 **Fax:** +91 79 2687 3922

**Email:** secretarial@sambhaav.com **Website:** www.sambhaav.com

**EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER ENDED ON JUNE 30, 2023**

(₹ in Lakhs Except EPS)

| SN | Particulars                                                                                                                                | Standalone    |            |            |            | Consolidated  |            |            |            |
|----|--------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------|------------|------------|------------|---------------|------------|------------|------------|
|    |                                                                                                                                            | Quarter Ended |            | Year Ended |            | Quarter Ended |            | Year Ended |            |
|    |                                                                                                                                            | 30-06-2023    | 31-03-2023 | 30-06-2022 | 31-03-2023 | 30-06-2023    | 31-03-2023 | 30-06-2022 | 31-03-2023 |
|    | (Refer Notes below)                                                                                                                        | Unaudited     | Audited    | Unaudited  | Audited    | Unaudited     | Audited    | Unaudited  | Audited    |
| 1  | Total Income from Operations (net)                                                                                                         | 662.62        | 970.76     | 1,151.48   | 4,020.90   | 664.12        | 970.75     | 1,151.48   | 4,033.25   |
| 2  | Net Profit/(Loss) for the period before Tax, Exceptional items                                                                             | (236.63)      | 107.62     | (128.28)   | 9.74       | (242.41)      | 102.66     | (178.05)   | (66.32)    |
| 3  | Net Profit/(Loss) for the period before tax (after Exceptional items)                                                                      | (236.63)      | 107.62     | (48.28)    | 89.74      | (252.45)      | 105.52     | (155.03)   | (37.30)    |
| 4  | Net Profit/(Loss) for the period after tax (after Exceptional items)                                                                       | (164.25)      | 74.24      | (73.38)    | (14.06)    | (178.70)      | 72.03      | (170.17)   | (124.51)   |
| 5  | Net Profit/(Loss) from discontinued operations after tax                                                                                   | (3.57)        | (80.01)    | (53.61)    | (135.58)   | (3.57)        | (80.01)    | (53.61)    | (135.58)   |
| 6  | Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | (167.74)      | (5.97)     | (129.45)   | (152.62)   | (182.19)      | (8.18)     | (223.62)   | (260.44)   |
| 7  | Equity Share Capital (Face Value of ₹ 1/- per share)                                                                                       | 1,911.11      | 1,911.11   | 1,911.11   | 1,911.11   | 1,911.11      | 1,911.11   | 1,911.11   | 1,911.11   |
| 8  | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year                                        | -             | -          | -          | 6,297.92   | -             | -          | -          | 6,349.20   |
| 9  | Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)                                                             |               |            |            |            |               |            |            |            |
|    | Basic and diluted EPS before Exceptional items (₹) - Continuing operations                                                                 | (0.09)        | 0.04       | (0.08)     | (0.05)     | (0.09)        | 0.04       | (0.10)     | (0.08)     |
|    | Basic and diluted EPS before Exceptional items (₹) - Discontinuing operations                                                              | (0.00)        | (0.04)     | (0.03)     | (0.07)     | (0.00)        | (0.04)     | (0.03)     | (0.07)     |
|    | Basic and diluted EPS after Exceptional items (₹)                                                                                          | (0.09)        | (0.00)     | (0.07)     | (0.08)     | (0.10)        | (0.00)     | (0.12)     | (0.14)     |

1 The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on August 12, 2023 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) and also on the Company's website at [www.sambhaav.com](http://www.sambhaav.com).

**Place :** Ahmedabad  
**Date :** August 12, 2023

**For and on behalf of the Board of Directors**  
**Manoj B Vadodaria**  
**Chairman and Managing Director**  
**DIN: 00092053**